

RP WEB SOLUTIONS
Website For Everyone...

Ronak Palan
Web Consultant

+91 84888 55506

rpwebsolutions2020@gmail.com

(ટેક્સ સંલગ્ન તથા અન્ય મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરતું માસિક)

ટેક્સ ટુડે

RNI No.GUJGUJ/2016/74805

Tax Today (Monthly)

કરવેરા સલાહકાર

સીધા અને આડકતરા કરવેરાની સાદી અને સરળ ભાષામાં માહિતી આપતું ગુજરાતી પખવાડિક વાર્ષિક લવાજમ :- ૩૩૯૫

સંપર્ક:-
પૂજા પબ્લિકેશન
મનિષ શાહ
૯૯૨૪૧ ૧૯૩૨૯

Post. Regn. No. G-JND/338/2020-2022. - Office of posting Una Post Office on 3rd Monday of Every Month

વર્ષ: ૮, અંક: ૧૦, સળંગ અંક: ૯૩, તા.૧૮/૦૮/૨૦૨૪, શનિવાર, પાના-૪, છૂટક અંકની કિંમત રૂ.૨૦, વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/- (કુરિયર સાથે રૂ.૩૦૦/-)
તંત્રી-માસિક અને પ્રકાશક: ભવ્ય ટિપકભાઈ પોપટ, પ્રકાશન સ્થળ: ૨૦૨-૨૦૩, ધ્રુવ કોમ્પ્લેક્સ, પોલીસ લાઇન સામે, ઉના, જી.ગીર સોમનાથ-૩૬૨૫૬૦
ફોન : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, ફેક્સ: ૦૨૮૭૫-૨૨૧૭૦૦, મો. : ૯૯૨૪૧ ૨૧૭૦૦ મુદ્રણ સ્થળ : પ્રથમેશ ઓફસેટ, ગોંદરા ચોક, ઉના

e-mail: taxtodayuna@gmail.com ◆ e-mail: editor@taxtoday.co.in ◆ www.taxtoday.co.in

ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત દ્વારા ખેડા વડા મથકે સ્વતંત્રતા દિનની ઉજવણી

તા. ૧૫.૦૮.૨૦૨૪

આજરોજ ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડા મથકમાં સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાબા (ખેડા) ખાતે કરવામાં આવી. સર્વપ્રથમ પ. પૂ. શ્રીજી સ્વામી ના વરદ હસ્તે ધ્વજ ફરકાવેલ અને સૌ ઉપસ્થિતોએ સલામી આપીને સમૂહમાં રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવેલ. ગુરુકુળના શ્રીજી સ્વામી, આચાર્ય જીગ્નેશભાઈ પટેલ અને ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતના પ્રમુખ જયદીપભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. ગુરુકુળના વિદ્યાર્થીઓ સ્વતંત્રતા દિન નિમિત્તે

વિવિધ ક્રાંતિવીરો પર વક્તવ્ય અને કલાકૃતિ રજૂ કરીને સૌ શ્રોતા ને મંત્ર મુગ્ધ કરી દીધેલ. આ પ્રસંગે ગુરુકુળના સ્વામીશ્રીઓ, પ્રમુખ જયદીપ પટેલ, મંત્રી અનિલ ટીમ્બડીયા, ટ્રસ્ટી અને પાર્ટ પ્રેસિડેન્ટ મધુસુદન પટેલ, ભૂ. પૂ. પ્રમુખ મા દિપક શાહ, સુધીરભાઈ યાજ્ઞિક, રાકેશભાઈ કક્કર કારોબારી સભ્યોમાં અમિત સોની, અનિલ પરીખ, લેડીઝ વિંગ પ્રમુખ જલ્પા પટેલ, શાળા આચાર્ય જીગ્નેશ પટેલ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

અમિત સોની, ટેક્સ ટુડે

પાલનપુર ખાતે “એનાલીસીસ યુનિયન બજેટ”નો એક દિવસીય સેમીનાર યોજાયો

તા. ૦૮/૦૮/૨૦૨૪

કવિઓ અને સાહિત્યકારઓની કલા નગરી પાલનપુરમાં જ્ઞાનની તૃષ્ણાને તૃપ્ત કરવાં પધારતાં માં શારદાના ઉપાસક એવા કરવેરા સલાહકારો માટે નોર્થ ગુજરાત ટેક્સ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશન તથા ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્સ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૮/૦૮/૨૦૨૪ને ગુરુવારના રોજ નંદીની રેસ્ટોરેન્ટ એન્ડ બેન્કવેટ, ડી-માર્ટ પાસે, ગઠામણ ચોકડી, પાલનપુર-અમદાવાદ હાઈવે પાલનપુર - ૩૮૫૦૦૧ (બ.કાં.) ખાતે “એનાલીસીસ યુનિયન બજેટ” નામે એક દિવસીય સેમીનારનું ઉમદા આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં બંને એસોસિએશનના સભ્યો હાજર રહેલા. સેમિનારના ચેરમેનશ્રી શાંતિલાલ સી કક્કર તથા સુભાષભાઈ શાહ દ્વારા ખુબજ ટુંકા સમયમાં પણ, સરસ આયોજન કર્યું જે તઓના અનુભવોનો આયનો હતો.

આમ સેમિનાર તેના નિર્ધારિત સમયે શરૂ થયો, સૌ પ્રથમ નોર્થ ગુજરાત ટેક્સ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશન પ્રમુખશ્રી દિલીપભાઈ કક્કર, મંત્રીશ્રી નરેશભાઈ પરમાર તથા ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્સ પ્રેક્ટીશ્નર્સ એસોસિએશન પ્રમુખશ્રી શૈલેષભાઈ મહેસુરીયા, મંત્રીશ્રી અશોકભાઈ કક્કર દ્વારા મહેમાનોનું ભુકે અને મોમેન્ટો આપી સ્વાગત અને સન્માન કર્યું અને બન્ને વક્તાશ્રીનો પરિચય આપ્યો ત્યાર બાદ પ્રથમ વક્તાશ્રી CA રશિમન વાજાએ જી.એસ.ટી કાયદા અંગે અને બીજા વક્તાશ્રી CA પલક પાવાગઢીએ ઈન્કમેટેક્સ કાયદા અંગે યુનિયન બજેટ અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ખૂબ જ સરળ ભાષામાં સમજ આપી. ત્યારે બાદ આભાર વિધિ કરી અને રાષ્ટ્રગાન કરી સેમિનારનું સમાપન કરવામાં આવ્યું. આમ એકંદરે દૂર દૂરથી ખૂબ જ મોટી સંખ્યામાં વકીલ મિત્રોએ હાજરી આપી આ એક દિવસીય સેમીનારને યાદગાર બનાવેલ.

હર્ષદ ઓઝા ટેક્સ ટુડે

જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા બોગસ વેપારી તથા બોગસ બિલિંગ વિરુદ્ધ સમગ્ર દેશમાં શરૂ થશે ઝુંબેશ

૧૬ ઓગસ્ટ થી ૧૫ ઓક્ટોબર સુધી બે મહિના ચાલશે ખાસ તપાસ



તા. ૧૩.૦૮.૨૦૨૪

જી.એસ.ટી. નું સંચાલન કરતી સંસ્થા CBIC એટલે કે સેન્ટરલ બોર્ડ ઓફ ઈંડાયસ્ટ્રીલ ટેક્સ અને કસ્ટમ્સ દ્વારા તારીખ ૧૬ ઓગસ્ટથી બે મહિના માટે સમગ્ર દેશમાં બોગસ વેપારી તથા બોગસ બિલિંગ કરતાં વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં બોગસ-હયાત ના હોય તેવા વેપારી તથા બોગસ બિલિંગ કરી સરકારને ચૂનો લગાડતા વેપારીઓને પકડી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બોગસ વેપારીઓ તથા બોગસ બિલિંગ અંગે મે ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન પ્રથમ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એ પ્રકારે જ આ દ્વિતીય

સેન્ટરલ અને સ્ટેટ જી.એસ.ટી. (કેન્દ્ર તથા રાજ્ય જી.એસ.ટી.) વિભાગ આ બાબતે તાલથી તાલ મિલાવી કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સેન્ટરલ અને સ્ટેટ જી.એસ.ટી.માં આ અંગે ખાસ “ઝોન” બનાવવામાં આવશે. આ પ્રત્યેક ઝોનમાં “નોડલ ઓફિસર”ની નિમણૂક કરવામાં આવશે. આ નોડલ અધિકારી પોતાના ઝોનમાં આ ખાસ કામગીરી બાબતે માહિતીની આપલે તથા કામગીરી ઉપર નજર પણ રાખશે. આ વ્યવસ્થા અંતર્ગત બન્ને એજન્સી પાસે રહેલી “આર્ટિ ફીશીયલ ઈટેલિજન્સ પ્રોગ્રામ” વડે બોગસ વેપારીઓની (અનુસંધાન બીજા પાને)

Best resort for Corporate events, Staff Tours etc. nr Diu

Flamingo Club & Resort

Why Flamingo is best for Corporate events??

- Nearly 40% of cost then similar hotels of Diu.
- 12% GST Credit available as situated in Gujarat.
- Facilities of Banquets and Party lawns.
- Special Suite rooms for top management.
- Best resort for family and group entertainment
- Pure Veg Restaurant
- Best in class amenities
- Water Sports facility support
- No burden of Liquor on corporates.

Amenities

- Swimming pool
- Mini Theatre*
- Gym & Indoor Sports
- Party Lawn
- Banquet
- Children Play Area

Contact: 9737021700 GM /9624121700 Front Desk
e mail: contact@flamingoclubresort.com, www.flamingoclubresort.com
Delwada Diu Road, Naliya Mandvi Ta Una. 362520

‘ટેક્સ ટુડે’ પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છા...

એડવોકેટ-અપૂર્વ મહેતા
પ્રમુખ

એડવોકેટ હેમલ કામદાર
સેક્રેટરી

રાજકોટ કોમર્શિયલ ટેક્સ બાર એસો.ના હોદ્દાદારોને ‘ટેક્સ ટુડે’ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન...

GST હેઠળ લાગુ થયું છે નવું FORM GSTR-1A. આ ફોર્મની સરળ ભાષામાં સમજૂતી આપતો આ ખાસ લેખ વાંચો



By પ્રશાંત મવ્યાલ

પ્રસ્તાવના

નોટીફિકેશન નંબર ૧૨/૨૦૨૪ સેન્ટ્રલ ટેક્સ તારીખ ૧૦/૦૭/૨૦૨૪ ના રોજ FORM GSTR-1A જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી FORM GSTR-1 રીવાઈઝ કરવાની કોઈ સુવિધા હતી નહિ. GSTR-1માં કોઈ ભૂલ થય ગય હોય અથવા કોઈ બીલ અપલોડ કરવાનું રહી ગયું હોય તો તેના માટે FORM GSTR-1A જાહેર કરવામાં આવ્યું છે. આ આર્ટિકલમાં FORM GSTR-1Aની સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી છે.

FORM GSTR-1A

- FORM GSTR-1A વૈકલ્પિક સુવિધા છે. FORM GSTR-1A ફાઈલ કરવું ફરજિયાત નથી.
- FORM GSTR-1A ટેક્સ પીરીયડ માટે એક જ વાર ફાઈલ થય શકશે.
- FORM GSTR-1A ઓગસ્ટ-૨૦૨૪થી પોર્ટલ પર લાઈવ થય ગયું છે અને તે જુલાઈ-૨૦૨૪ના ટેક્સ પીરીયડથી લાગુ પડશે.
- FORM GSTR-1Aમાં આઉટપુટ ટેક્સ લાયબીલીટીમાં જે વધારો કે ઘટાડો થશે તે જે ટેક્સ પીરીયડનું FORM GSTR-1A ભર્યું છે તેજ ટેક્સ પીરીયડના GSTR-3B માં ઓટો અપડેટ થય જશે.

ઉદાહરણ

- જુલાઈ ૨૦૨૪ના ટેક્સ પીરીયડ માટે FORM GSTR-1A ફાઈલ કર્યું હોય તો FORM GSTR-1Aમાં ટેક્સ લાયબીલીટીમાં વધારો કે ઘટાડો થયો હોય તે જુલાઈ-૨૦૨૪ના GSTR-3Bમાં ઓટોમેટિક અપડેટ થય જશે.
- જે માલ કે સેવા રીસીવ કરે છે તેના GSTR-2B માં FORM GSTR-1A દ્વારા જે ફેરફાર થયો હોય તે જે ટેક્સ પીરીયડનું FORM GSTR-1A ફાઈલ કર્યું હોય ત્યાર પછીના ટેક્સ પીરીયડ માં બતાવશે.

ઉદાહરણ

- જુલાઈ-૨૦૨૪ના ટેક્સ પીરીયડ માટે FORM GSTR-1A ફાઈલ કર્યું હોય તો ટેક્સ લાયબીલીટીમાં વધારો કે ઘટાડો થયો હોય તો તે રીસીપ્ટન્ટને ઓગસ્ટ-૨૦૨૪ ના ટેક્સ પીરીયડનું GSTR-2B જનરેટ થશે તેમાં બતાવશે.
- જે કરદાતા મંથલી GSTR-1 ફાઈલ કરે છે તે કરદાતાને પોર્ટલ પર FORM GSTR-1A GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ અથવા

- જે તારીખે GSTR-1 ફાઈલ કરવામાં આવે તે તારીખ આ બંને તારીખ માં જે તારીખ પછી આવે ત્યારથી બતાવશે.
- GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછી GSTR-1 ફાઈલ કરવામાં આવે તો જ્યારે GSTR-1 ફાઈલ કરી ત્યારથી FORM GSTR-1A પોર્ટલ પર બતાવશે.

ઉદાહરણ

- મંથલી રીટર્ન ફાઈલ કરતા કરદાતા માટે જુલાઈ મહિનાનું GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૧/૦૮/૨૦૨૪ છે.
- કરદાતા GSTR-1 ૧૫/૦૮/૨૦૨૪ ના રોજ ફાઈલ કરે છે. FORM GSTR-1A ૧૫/૦૮/૨૦૨૪ના રોજ GSTR-1 રીટર્ન ફાઈલ કર્યા પછી પોર્ટલ પર બતાવે.
- કરદાતા GSTR-1 ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ ફાઈલ કરે છે તો FORM GSTR-1A ૧૧/૦૮/૨૦૨૪ના રોજ પોર્ટલ પર બતાવશે.
- જે કરદાતા ત્રીમાસીક GSTR-1 ફાઈલ કરે છે તે કરદાતાને પોર્ટલ પર FORM GSTR-1A GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ અથવા

અથવા

- જે તારીખે GSTR-1 ફાઈલ કરવામાં આવે તે તારીખ આ બંને તારીખ

માં જે તારીખ પછી આવે ત્યારથી બતાવશે.

- GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ પછી GSTR-1 ફાઈલ કરવામાં આવે તો જ્યારે GSTR-1 ફાઈલ કરી ત્યારથી FORM GSTR-1A પોર્ટલ પર બતાવશે.

ઉદાહરણ

- ત્રિમાસીક રીટર્ન ફાઈલ કરતા કરદાતા માટે જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૪ના ક્વાટરનું GSTR-1 ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૧૩/૧૦/૨૦૨૪ છે.
- કરદાતા GSTR-1 ૧૫/૧૦/૨૦૨૪ના રોજ ફાઈલ કરે છે. FORM GSTR-1A ૧૫/૧૦/૨૦૨૪ ના રોજ GSTR-1 રીટર્ન ફાઈલ કર્યા પછી પોર્ટલ પર બતાવે.
- કરદાતા GSTR-1 ૦૮/૧૦/૨૦૨૪ ના રોજ ફાઈલ કરે છે તો FORM GSTR-1A ૧૩/૧૦/૨૦૨૪ ના રોજ GSTR-1 રીટર્ન ફાઈલ કર્યા પછી પોર્ટલ પર બતાવે.
- જે કરદાતા ત્રીમાસીક GSTR-1 ફાઈલ કરે છે તે કરદાતા એ FORM GSTR-1A ત્રિમાસીક જ ફાઈલ કરી શકશે.
- જે કરદાતા ત્રિમાસીક GSTR-1A ફાઈલ કરે છે તેમને ક્વાટર ના

પહેલા અને બીજા મહિનામાં FORM GSTR-1A પોર્ટલ પર બતાવે નહિ.

- ટેક્સ પીરીયડનું GSTR-3B ફાઈલ કરી ત્યાં સુધી FORM GSTR-1A પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.
- રીસીપ્ટન્ટના GST નંબર માં ફેરફાર કરવાનો હોય કે સુધારો કરવાનો હોય તે GSTR-1A દ્વારા થય શકશે નહિ.
- ટેક્સ પીરીયડ માટે જે ટેક્સ પીરીયડનું GSTR-3B ફાઈલ કરી ત્યાર પછી તેજ ટેક્સ પીરીયડનું GSTR-1A ફાઈલ થય શકે નહિ.

ઉદાહરણ

- જુલાઈ-૨૦૨૪ના ટેક્સ પીરીયડ માટે જુલાઈ-૨૦૨૪નું GSTR-3B ફાઈલ કરી ત્યાર પછી જુલાઈ ૨૦૨૪નું GSTR-1A ફાઈલ કરી શકી નહિ.
- GSTR-1માં જો કોઈ સુધારો કરવાનો હોય તોજ GSTR-1A ફાઈલ કરવાનું હોય છે. NILL GSTR-1A ફાઈલ કરવાનું હોય નહિ.
- GSTR-1Aમાં ફક્ત કરંટ ટેક્સ પીરીયડના GSTR-1માં કોઈ સુધારો કરવાનો હોય તો તે થય શકે. જુના ટેક્સ પીરીયડના GSTR-1માં જે રેકૉર્ડ અપલોડ થયા હોય તેનું અમેન્ડમેન્ટ કરંટ GSTR-1માં થય શકે નહિ.

ઉદાહરણ

- જુન મહિનાના GSTR-1માં કોઈ અમેન્ડમેન્ટ કરવાનું હોય તો જુલાઈ મહિનાના GSTR-1Aમાં તેનું અમેન્ડમેન્ટ થય શકે નહિ.
- GSTR-1Aમાં કોઈ ડેટા સેવ કરેલો હોય અને GSTR-1A ફાઈલ નો કર્યું હોય તો GSTR-3B ફાઈલ કરતા સમયે ERROR આવશે. એટલે સૌ પ્રથમ GSTR-1A ફાઈલ કરવું પડે અથવા GSTR-1Aમાં જે રેકૉર્ડ હોય તે ડિલીટ કરવા પડે અથવા GSTR-1A રીસેટ કરવું પડે પછીજ GSTR-3B ફાઈલ થઈ શકશે.
- GSTR-1Aમાં કોઈ ફેડીટ નોટ કે ડેબીટ નોટ એડ કરવી હોય તો તે કરી શકાશે.
- GSTR-1A કોઈ પણ ટેક્સ પીરીયડ માટે એક જ વાર ફાઈલ થય શકશે.

GSTR-1A બહુ જ ઓછું ઉપયોગી થાય તેવું લાગુ રહ્યું છે કેમ કે, GSTR-1Aમાં જે આઉટપુટ લાયબીલીટીમાં ધારો કે ઘટાડો થશે તે જે તે ટેક્સ પીરીયડનું GSTR-1A ફાઈલ કર્યું હોય તેના GSTR-3Bમાં ઓટોમેટિક આવી જશે પરંતુ સપ્લાયરને કે જે માલ કે સેવા રીસીવ કરે છે તે રીસીવરને તેના GSTR-2Bમાં જે ટેક્સ પીરીયડનું GSTR-1A ફાઈલ કર્યું છે તેના પછીના પીરીયડ માં અવેઈલેબલ થશે જે એક રીતે યોગ્ય લાગતું નથી તેથી GSTR-1Aનો ઉપયોગ મહદંશે બહુ ઓછો રહેશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.

(લેખક યાનગઢ ખાતે ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સ ઉપર પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)

Whether the Condonation Appeal can be rejected without providing the Opportunity of Personal Hearing?



By Advocate Bhargav Ganatra, Rajkot, Gujarat

Background:-

It has been come to my knowledge that GST Appeals which were filed beyond the period of 4 months from the date of order, are being summarily rejected on the basis delay in filing appeal. A key concept of date of communication of appeal is being missed??

Thus, in this chaotic situation, A Key Question has been raised that, Whether the Condonation Appeal can be rejected without providing the Opportunity of Personal Hearing.

What is the Legal Provision?:-

Section 107(1) of CGST Act, 2017 states that Any person aggrieved by any decision or order passed under this Act or the State Goods and Services Tax

Act or the Union Territory Goods and Services Tax Act by an adjudicating authority may appeal to such Appellate Authority as may be prescribed within three months from the date on which the said decision or order is communicated to such person.

Further, Section 107(4) of CGST Act, 2017 states that The Appellate Authority may, if he is satisfied that the appellant was prevented by sufficient cause from presenting the appeal within the aforesaid period of three months or six months, as the case may be, allow it to be presented within a further period of one month.

Thus, Whether the time barred Appeal [i.e. Appeal Which were filed beyond the period of 4 months from the date of communication of order] can be condoned by Appellate Authority or not is already a burning question.

For this, there are divergent views of different High Courts on the Issue.

For Example, Hon'ble Allahabad High Court in the case of M/s. Garg Enterprise vs. State of UP and Ors. has held that, "Section 107 of the

Act specifically provides for the limitation and in the absence of any clause condoning the delay by showing sufficient cause after the prescribed period, there is complete exclusion of Section 5 of the Limitation Act."

Whereas, Hon'ble Calcutta High Court in the case of S.K. Chakraborty & Sons Vs. Union of India & Ors. has held that, "in our view, since provisions of Section 5 of the Act of 1963 have not been expressly or impliedly excluded by Section 107 of the Act of 2017 by virtue of Section 29 (2) of the Act of 1963, Section 5 of the Act of 1963 stands attracted."

However, whatsoever may be the one believe, Appellate Authority may or may not condone the delay beyond 1 month, but whether one can say that just because your appeal was filed beyond the period of 4 months from the date of communication of order and therefore there is no need of opportunity of personal hearing?

Whether the condonation Appeal can be rejected without providing the Opportunity of Per-

sonal Hearing?

Section 107(8) of the CGST Act, 2017 states that The Appellate Authority shall give an opportunity to the appellant of being heard.

Thus, it is very crystal clear that if any appeal has been filed with the Appellate Authority, whether time barred or not, then he shall get the opportunity of personal hearing.

Further, Hon'ble Supreme Court in the case of Union of India Versus Jesus Sales Corporation has held that, "The Appellate authority may dispense with such deposit in its discretion. The proviso relating to the condonation for delay in filing the appeal is more or less on the pattern of Section 5 of the Limitation Act. Somehow, a practice has grown throughout the country that before rejecting the prayer for condonation of delay in filing the appeal or application, opportunities are given to the appellants or petitioners, as the case may be, to be heard on the question whether such delay be condoned. Opportunities to be heard are also the contesting respondents in such appeals. In differ-

ent statutes given to where power has been vested in the Appellate authority to condone the delay in filing such appeals or applications, there are no specific provisions in those statutes saying that before such delays are condoned the appellants or the applicants shall be heard, but on basis of practice which has grown during the years the courts and quasijudicial authorities have been hearing the appellants and applicants before dismissing such appeals or applications as barred by limitations. It can be said that courts have read the requirements of hearing the appellants or the applicants before dismissing their appeals or applications filed beyond time on principle of natural justice, although the concerned statute does not prescribe such requirement specifically."

Moreover, Hon'ble Gujarat High Court in his landmark judgement of Aggarwal Dyeing and Printing Works Versus State of Gujarat had drawn the attention of the Appellate Authority who had mechanically disposed of the appeals on the ground of delay. Ad-

ditionally, It has been observed that, "Apt would be to revisit the observations of the Supreme Court with regard to reasonable opportunity in the case of Union of India vs. Jesus Sales Corporation, reported in 1996 (4)SCC 69, wherein it is observed that a practice has developed holding that even in the absence of a provision providing for an opportunity of hearing, such a provision is required to be read into the Rules governing the case, particularly, when an order being made is likely to have civil consequences. The Hon'ble Supreme Court has emphasize up on the appellate court to have the approach tilting in favour of providing fair and reasonable opportunity of hearing while dealing with condonation of delay application in filing appeal."

We may have heard that it is settled legal position of law that reasons are heart and soul of the order and non-communication of same itself amounts to denial of reasonable opportunity of hearing, resulting in miscarriage of justice.

In the end, In My Humble Opinion, Appel-

late Authority shall dispose the appeal after providing the reasonable opportunity of hearing and discussing the merits of the case too. If this has been done, then only question that will pertain before the Hon'ble Tribunal or Hon'ble High Court is that, Whether Condonation needs to be allowed or not?

Conclusion :-

As previously men-

tioned, several appeals have been mechanically disposed of on the ground of delay. However, it is very obvious fact that every taxpayer will not travel to High Court for the sake of justice.

Hence, I want to conclude my discussion with the quote of Nani Palkhivala that, "We must get away from the fallacy of the legal solubility of all problems."

જી.એસ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા

(અનુસંધાન પાના ૧થી શરૂ...)

ઓળખ કરવામાં આવશે આ ઉપરાંત ઈ વે બિલની વિગતો, વેપારીની અગાઉની સંડોવણી, અધિકારીના પાછલા અનુભવ આધારિત પણ કામગીરી હાથ ધરવામાં આવશે. કોઈ વેપારી બોગસ વેપારી છે તેવી માહિતી મળતા જે તે અધિકારી દ્વારા તે વેપારીની સમયસર ચકાસણી કરવાની રહેશે. આ ચકાસણી દરમિયાન આ વેપારી હયાત ના જણાય કે બોગસ જણાય તો તુરંત જ અધિકારી દ્વારા આ વેપારીનો નોંધણી દાખલો રદ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. આવા વેપારીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાની કાર્યવાહી પણ જરૂર જણાય ત્યાં અધિકારી દ્વારા કરવાની રહેશે. આવા વેપારી પાસેથી ખરીદી કરનાર વેપારી ઉપર પણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની રહેશે. જો ખરીદનાર વેપારીનો ધંધો અન્ય અધિકારીના ક્ષેત્રાધિકાર હેઠળ પડતો હોય તો આ અધિકારીને તપાસ કર્યા અધિકારી દ્વારા ખરીદનાર વેપારીની વિગતો મોકલવાની રહેશે અને આ માહિતી મળતા ખરીદનાર વેપારી ઉપર ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારી દ્વારા સમયસર ખરીદનાર ઉપર કાર્યવાહી કરવાની રહેશે. સમગ્ર પ્રકરણમાં બોગસ બિલિંગના "માસ્ટર માઈન્ડ"ને પકડવા પણ અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવવાની રહેશે.

આ અંગે વાત કરતાં જાણીતા એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે "આ ઝુંબેશથી પ્રમાણિક વેપારીઓએ ડરવાની કોઈ જરૂર નથી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બોગસ વેપારીઓને પકડવાનો તથા તેની ઉપર કાર્યવાહી કરવાનો છે. હા પ્રમાણિક વેપારીઓએ પોતાના ધંધાના સ્થળના સરનામા પોતાના જી.એસ.ટી. નોંધણી દાખલામાં યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું આવશ્યક છે. આ ઉપરાંત પોતાના ધંધાના બોર્ડ વ્યવસ્થિત રીતે ધંધાનું નામ, માલિકનું નામ ધરાવે છે તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ. આ પ્રકારની ઝુંબેશ પ્રમાણિક વેપારીઓ માટે ખાસ કોઈ મુશ્કેલી નહીં કરે તેવું હું માનું છું." ૧૬ ઓગસ્ટથી શરૂ થતી આ ઝુંબેશમાં બોગસ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી છે પરંતુ પ્રમાણિક વેપારીઓ ઉપર આ ઝુંબેશની અસરના પડે તે રીતે કેન્દ્ર તથા રાજ્ય જી.એસ.ટી. ના અધિકારીઓ કામ કરે તેવી આશા સેવાઈ રહી છે.

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

(આ અખબાર પ્રકાશિત કરવામાં શક્ય તેટલી કાળજી લેવામાં આવેલ છે. છતાં આ લેખનાં વિચારો લેખકોના અંગત મંતવ્યો પર આધાર રાખે છે. ટેક્સ ટુડે માલિક અથવા તંત્રી આ અંગે કોઈ રીતે જવાબદાર રહેતા નથી.)



By Bhavya Popat, Tax Advocate
Dt. 15.08.2024

સ્વતંત્રતા પર્વ ઉપર આજે એક ખાસ લેખ લખી રહ્યો છું. આ પર્વને અનુરૂપ આ લેખમાં કરદાતાને ખરી રીતે સ્વતંત્રતા મળી રહે તે સુનિશ્ચિત કરવા અમુક સૂચનો આપવા પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશના બે મહત્વના ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) તથા ઇન્કમ ટેક્સ કાયદાઓ હેઠળ કરદાતાઓને પડતી તકલીફો રજૂ કરવા આ પ્રયાસ છે. સરકાર ગમે તેટલું કરે તો પણ કોઈ પણ કાયદામાં અમુક ત્રુટિઓ-ખામીઓ રહી જ જતી હોય છે. આ ખામીઓ દૂર કરવામાં આવે તો ભારતીય ટેક્સ સિસ્ટમ થોડી વધુ સરળ, થોડી વધુ કરદાતા કેન્દ્રી બની શકે તેમ છે. આ લેખમાં ક્યાં ક્યાં ફેરફારો કરવાથી ટેક્સ સિસ્ટમ વધુ કરદાતા લક્ષી બનશે તે અંગે મારા વિચારો રજૂ કર્યા છે.

જી.એસ.ટી. કાયદો છે આ બાબતો પર અન્યાયી!!

જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાની સ્વતંત્રતા

જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવાઓ હાલના સંજોગોમાં ખૂબ મુશ્કેલ બની ગયો છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરીના અનેક કોભાંડો બહાર આવ્યા છે. આ કોભાંડોના કારણે દરેક નવા નોંધણી દાખલાની અરજીને શંકાની નજરે જોવામાં આવે છે. આ કારણે ખૂબ મોટા પ્રમાણમાં જી.એસ.ટી. ની અરજી ના મંજૂર થઈ હોવાના સમાચાર જમીની સ્તરે મળી રહે છે. એક તરફ સરકારી આવક વધારવાની કવાયત કરવામાં આવતી હોય છે તો તેની સામે જી.એસ.ટી. નંબર ના આપવાની આ નીતિ આવક માં વધારો કરવાના બદલે ઘટાડો કરે છે. અનેક કરદાતાઓ જી.એસ.ટી. નંબર જરૂરી હોવા છતાં, જી.એસ.ટી. નિયમોમાં જણાવેલ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં જી.એસ.ટી. નંબર મેળવી શકતા નથી. આ સ્વતંત્રતા પર્વ પર કરદાતાઓને જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવામાં સ્વતંત્રતા મળે તે જરૂરી છે. નાના નાના કારણ દર્શાવી કરદાતાની અરજી નામંજૂર કરવામાંથી પણ કરદાતાને સ્વતંત્રતા મકલે તેવી આશા.

જી.એસ.ટી. હેઠળ CGST-SGSTની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ એક બીજા સામે લઈ શકે તેની સ્વતંત્રતા

“સિમલેસ ક્રેડિટ”ના મુખ્ય હેતુ સાથે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. માં હાલ જી.એસ.ટી. ક્રેડિટ મેળવવી ખૂબ અઘરી બની ગઈ છે. કરદાતા પાસે SGSTની ક્રેડિટ હોવા છતાં, CGST “કેશ”માં ભરવા જવાબદારી આવતી હોય છે. આ પ્રકારે કરદાતા પાસે ક્રેડિટ હોવા છતાં તેઓ “કેશ”માં ટેક્સ ભરવા જવાબદાર બને તે અયોગ્ય ગણી શકાય. ખરેખર કરદાતાને SGSTમાંથી CGSTની રકમ ભરવા છૂટ આપવામાં આવે અને ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય દ્વારા આ અંગે કોઈ પદ્ધતિ વિકસાવી સરકારી ધોરણે એક બીજા સાથેના એકાઉન્ટ સરભર કરવા જોઈએ. કરદાતા પોતાની પાસેની ક્રેડિટ કોઈ પણ ટેક્સ ભરવા વાપરી શકે તે અંગેની સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

એક રાજ્યની CGST ક્રેડિટ અન્ય રાજ્યના CGST ભરવા સામે ઉપયોગ કરી શકે તેની સ્વતંત્રતા

જી.એસ.ટી.નો USP (યુનિક સેલ્સ પ્રપોઝીશન) “વન નેશન, વન માર્કેટ, વન ટેક્સ” હતો. આ USP હેઠળ સમગ્ર દેશમાં એક પ્રકારનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. કોઈ કરદાતા પાસે એક થી વધારે રાજ્યોમાં જી.એસ.ટી. નંબર ધરાવતા હોય અને જ્યારે એક રાજ્યમાં CGST ક્રેડિટ પડી હોય ત્યારે અન્ય રાજ્યમાં ભરવાં પત્ર CGST સામે છે બાદ મળવી જોઈએ. આમ છતાં અત્યાર સુધી, આ પ્રકારે આવા બહુ રાજ્ય ધંધા ચલાવતા કરદાતાઓ આ રીતે ક્રેડિટનો વપરાશ કરી શકતા નથી. SGST બાબતે વિચારીએ તો આ કદાચ શક્ય નથી કે વધુ અઘરું છે કારણ કે SGST ટેક્સ એ જે તે રાજ્ય પાસે રહે છે. જ્યારે CGST તો કેન્દ્ર સરકારનો ટેક્સ છે. આવા સંજોગોમાં CGSTની ક્રેડિટની આપલે એક રાજ્ય થી અન્ય રાજ્યમાં થઈ શકે તે અંગે કરદાતાઓને સ્વતંત્રતા મળે તે જરૂરી છે.



MRP બેઈઝ સેસ હોય ત્યારે “સેસ” આઉટપુટ અને ઇન્પુટમાં દર્શાવવાથી મળે સ્વતંત્રતા

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કોઈ રાજ્યની આવકમાં જી.એસ.ટી. લાગુ થવાને કારણે ઘટ આવે તો તે સરભર કરવા “કંપેન્સેશન સેસ” લાગુ કરવામાં આવ્યો છે. આ સેસ ઉધરાવવામાં હાલ મોટાભાગે MRP મુજબ સેસ ઉત્પાદન સમયે ઉધરાવવામાં આવી રહ્યો હોય, આ ટેક્સને “વન પોઈન્ટ ટેક્સેશન” માં લઈ જવો જરૂરી છે. દરેક સ્તરે આઉટપુટ ટેક્સ તરીકે દર્શાવી તેની ઇન્પુટ ટેક્સ ક્રેડિટ કલેઈમ કરવાની પદ્ધતિ માંથી કરદાતાને સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

“કેશ લેજર”નું રિફંડ કોઈ પણ જાતના પુરાવા માંગ્યા વગર આપવામાં આવે તે અંગે સ્વતંત્રતા

કરદાતાનું “કેશ લેજર” એ કરદાતાનું કરંટ ખાતું જ ગણી શકાય. કરદાતાના આ ખાતામાં રકમ જમા હોય અને આ રકમ કરદાતા દ્વારા રિફંડ સ્વરૂપે માંગવામાં આવે તો તેમાં ઓનલાઈન રિફંડ અરજી કરવા સિવાય કોઈ વધારાના પુરાવાઓ ના માંગવામાં આવે તે અંગે કરદાતાને સ્વતંત્રતા મળે તે જરૂરી છે. હાલ, એ બાબત સાચી છે કે “કેશ લેજર”નું રિફંડ સામાન્ય રીતે ખૂબ ઓછા પુરાવા માંગી સામાન્ય રીતે મોટા ભાગના અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે. પરંતુ આ પ્રકારે “કેશ લેજર” માં ઓનલાઈન અરજી સિવાય કોઈ વિધિ કરવાની ના રહે તો જ ખરેખર “કેશ લેજર” કરંટ ખાતા જેવું કામ આપી શકે તેમ ગણી શકાય.

“કોમન વર્કિંગ ડે કોન્સેપ્ટ” કરદાતાઓને પણ મળે તે અંગેની સ્વતંત્રતા

જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારી દ્વારા કોઈ કામ પૂર્ણ કરવા મુદત આપવામાં આવેલ છે આ મુદતની ગણતરી કરવામાં “કોમન વર્કિંગ ડે” એટલે કે એવા દિવસો જ ગણવામાં આવે છે જે દિવસોમાં સેન્ટરલ જી.એસ.ટી. અને સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ચાલુ હોય. બન્નેમાંથી એક પણ ખાતામાં રજા હોય તો આ સંજોગોમાં આ દિવસને અધિકારીની કામ પૂર્ણ કરવાની મુદતમાં ગણવામાં આવતો નથી. પરંતુ કરદાતાને આ પ્રકારે કોઈ લાભ આપવામાં આવતો નથી. કરદાતાઓને પણ જે દિવસો તહેવારની રજા હોય, રવિવાર હોય તેવા દિવસો જો મુદતનો છેલ્લો દિવસ પડતો હોય તો તેમાં સ્વયંભૂ વધારો થવાની સ્વતંત્રતા મળે તે જરૂરી છે. હમણાં પાછલી ૧૧ તારીખે જ્યારે GSTR 1 ભરવાની છેલ્લી તારીખ હતી અને જી.એસ.ટી.

પોર્ટલ સરખી રીતે ચાલતું ના હતું, તેવા સંજોગોમાં પણ કરદાતાઓને મુદત વધારાનો લાભ આપવામાં આવ્યો ના હતો.

જી.એસ.ટી.ના નોટિફિકેશન સાથે સરળ ભાષામાં ટ્રેડ નોટિસ બહાર પાડવામાં આવે તે અંગે સ્વતંત્રતા

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી સૌથી ચર્ચાસ્પદ બાબત કોઈ ગણી શકાય તો તે છે ખૂબ “ટેકનિકલ” ભાષામાં બહાર પાડવામાં આવતા નોટિફિકેશન. કરદાતાની વાત કે સામાન્ય વ્યક્તિની વાત તો દૂર રહી, ટેક્સ પ્રોફેશનલ્સ અને અધિકારીઓ પણ આ નોટિફિકેશનના અર્થઘટન કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. જ્યારે એવું માનવમાં આવતું હોય કે “Everybody is presumed to know law” એટલે કે દરેક વ્યક્તિ કાયદાને જાણે છે, તેવું વિધિ દ્વારા માની લેવામાં આવતું હોય ત્યારે જરૂર છે આ પ્રકારના “ટેકનિકલ નોટિફિકેશન” બાદ સરળ ભાષામાં “ટ્રેડ નોટિસ” બહાર પાડવામાં આવે. કરદાતાને જી.એસ.ટી. કાયદો સરળ રીતે સમજાવવામાં આવે તે સ્વતંત્રતા પણ જરૂરી છે.

ઇન્કમ ટેક્સ કાયદામાં આ ફેરફારો થાય તે છે જરૂરી

દરેક આકારણી આદેશ કલમ ૬૮/૬૮માં ના કરવામાં આવે તે અંગેની સ્વતંત્રતા

ઇન્કમ ટેક્સ કાયદાની વાત કરીએ તો જ્યારથી નોટબંધી લાગુ થઈ હતી ત્યારબાદ કરવામાં આવેલ મોટાભાગની (લગભગ તમામ) આકારણીમાં જો કોઈ રકમ ઉમેરવામાં આવે છે તે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૬૮ કે ૬૯ હેઠળ જ ઉમેરવામાં આવે છે. આમ, આ કલમ હેઠળ ઉમેરો થવાથી કરદાતાની આકારણીમાં જે રકમનો ઉમેરો કરવામાં આવેલ હોય ત્યારે લગભગ તેટલી જ રકમ જેટલું માંગણું ઊભું થઈ જતું હોય છે. આવા અનેક આકારણી આદેશ થયેલ છે જેમાં કરદાતાની આકારણીમાં ખોટી રીતે મોટી રકમ ઉમેરવામાં આવેલ હોય અને અપીલમાં આ રકમ દૂર કરી આપવામાં આવેલ હોય. પરંતુ આ આકારણી આદેશ પસાર થયાથી અપીલ આદેશ કરદાતાની તરફેણમાં આવે ત્યાં સુધી ખૂબ યાતના કરદાતાએ ભોગવવી પડતી હોય છે. આ સ્વતંત્ર દિને આશા રાખીએ કે આ બાબતે આકારણી અધિકારીને યોગ્ય સૂચના આપવામાં આવે. દરેક આકારણી આદેશમાં ઉમેરો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ ૬૮/૬૯ હેઠળ ના થાય તેની પણ કરદાતાને સ્વતંત્રતા મળી રહે.

મોટી ડિમાન્ડ પાળા આકારણી આદેશમાં ૨૦% ભરવા જેવો આગ્રહ ના રાખવામાં આવે તે અંગેની સ્વતંત્રતા

કરદાતાઓને આપો વિશેષ સન્માન, સમયની છે આ માંગ

"Honoring the Honest"નું સપનું હજુ છે ઘણું દૂર!!

એક વાર કરદાતા વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરી આપવામાં આવે છે ત્યારબાદ ગમે તેટલી મોટી ડિમાન્ડ હોય, કરદાતાને ૨૦% ટેક્સ ભરવા આગ્રહ કરવામાં આવતો હોય છે. કેસના તથ્યો જોયા વગર જ આ રકમ ભરવા આગ્રહ કરવામાં આવતા કરદાતા ખૂબ મુશ્કેલી અનુભવતા હોય છે. આવા સમયે કરદાતા સામે તેના રિટર્નમાં દર્શાવેલ આવકથી ખૂબ ઊંચી રકમની આકારણી થયેલ હોય તેવા કિસ્સામાં ખૂબ ઓછી/ન્યૂનતમ રકમ સ્વીકારી સ્ટે મેળવવાની સ્વતંત્રતા મળે તે જરૂરી છે.

ઇન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ્સ ભરવા પૂરતો સમય મળે તેની સ્વતંત્રતા

ઓડિટ લાગુ ના હોય તેવા કરદાતાઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા જે તે વર્ષ પછીના ૩૧ જુલાઈ સુધીનો સમય મળતો હોય છે. આમ તો ૦૧ એપ્રિલ થી ૩૧ જુલાઈ એટલે કે ચાર મહિના જેટલો સમય કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા આપવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવતું હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર રિટર્ન ભરવાની સગવડ સામાન્ય રીતે મોડી શરૂ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત હાલ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં AIS તથા TIS ખૂબ જરૂરી હોય, આ વિગતો ઇન્કમ ટેક્સ પોર્ટલમાં જૂના પહેલા અઠવાડિયા સુધીમાં અપડેટ થતી હોય છે. આમ, કરદાતા માટે આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા વ્યાવહારિક રીતે બે મહિનાથી પણ ઓછો સમય રહેતો હોય છે. જો આ મુદત ચૂકી જવામાં આવે તો “લેઈટ ફી” ના રૂપકડા નામ સાથે ની પેનલ્ટી તો ઊભી જ છે. ઓડિટ સિવાયના કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત ૩૧ ઓગસ્ટ કરી આપવામાં આવે તેવી સ્વતંત્રતા પણ કરદાતાઓ માટે જરૂરી છે.

ટેક્સ પેયર્સને આપવામાં આવે વિશેષ સન્માન:

આપણાં દેશમાં સ્વતંત્રતા દિન તથા ગણતંત્ર દિનની ઉજવણી લગભગ તમામ નાના મોટા શહેરોમાં થાય છે. આ ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ ઉજવણીના ભાગ રૂપે શહેર-ગામના નામી ડિફેન્સ પર્સનલ(આર્મીમેન વગેરે), સેવાભવિઓ, ડોક્ટરો, વરીષ્ઠ નાગરિકો, પત્રકારોના સન્માન કરવામાં આવતા હોય છે. પરંતુ શું ટેક્સ પેયર્સ-ટેક્સ ભરનારઓનું સન્માન થતું તમે જોયું છે??? ના, આપણાં દેશમાં ટેક્સ પેયર્સનું સન્માન કરવાની પદ્ધતિ શરૂ થઈ નથી. પરંતુ ટેક્સ શેરે પ્રોફેશનલ્સ કરતાં પ્રોફેશનલ્સ રીકે હું ચોક્કસ માનું છું કે આપણાં દેશમાં ટેક્સ પેયર્સનું સન્માન કરવાનો સમય આવી ગયો છે. ૧૫ ઓગસ્ટનો પ્રોગ્રામ હોય કે ૨૬ જાન્યુઆરીનો પ્રોગ્રામ હોય, દરેક ગામ તથા શહેરમાં સૌથી વધુ ટેક્સ ભરનાર ઓફિસમાં ઓછા ૧૦ વ્યક્તિઓનું દરેક ક્ષેત્રમાં જોરમાં સન્માન કરવાની વિશિષ્ટ પદ્ધતિ શરૂ કરવામાં આવવી જોઈએ. આ ઉપરાંત ટેક્સ પેયર્સને સરકાર દ્વારા વિવિધ સરકારી ક્ષેત્રોમાં વિશેષ આમંત્રણ આપવામાં આવવું જોઈએ. સ્થાનિક MP (સંસદસભ્ય) તથા MLA (ધારાસભ્ય) પાસે પણ આ પ્રકારે પોતાના મતવિસ્તારના ઊંચા ટેક્સ ભરનાર વ્યક્તિઓની યાદી હોવી જોઈએ. સરકારી ઓફિસો જેવી કે ઇન્કમ ટેક્સ, જી.એસ.ટી. ઓફિસ દ્વારા વિવિધ સ્થાનિક મિટિંગમાં આ ટેક્સ પેયર્સ સાથે વિચાર વિમર્શ કરતાં ક્ષેત્રો પણ નિયમિત રીતે યોજવામાં આવે તે જરૂરી છે. આ ક્ષેત્રોમાં ટેક્સ પેયર્સ માટે એક વિશેષ આગ્રહરોળ આપી તેઓનું સન્માન કરવું જોઈએ. આ ઉપરાંત સ્થાનિક સ્તરે આવા ટેક્સ પેયર્સની ફરિયાદ નિવારણ બાબતે અલગ “રિડ કાર્પેટ ચિન્ડો” હોવી જોઈએ. તેઓની સ્થાનિક સમસ્યાઓનું સમાધાન અગ્રતાથી કરવામાં આવે તે પણ જરૂરી છે. આ પ્રમાણે ટેક્સ પેયર્સનું સન્માન કરવામાં આવશે તો તેઓને વ્યક્તિત્વ રીતે તો ગૌરવપદ બાબતે લાગશે જ પરંતુ આ સાથે જ અન્ય લોકોને પણ પોતાનો ટેક્સ પ્રમાણિક પણે ભરવાની પ્રેરણા મળશે.

અને છેલ્લે

આપણે સૌ કરદાતાઓ માટે.....ઉપરની તમામ સ્વતંત્રતા એ મારા તમારા જેવા કરદાતાઓના હક્ક માટે જરૂરી છે પરંતુ દરેક હક્ક એ રજા પણ સાથે લઈ આવે છે. આપણાં સૌ માટે એ જરૂરી છે કે આપના દેશના વિકાસમાં આપણું યોગદાન આપીએ. આ માટે આપણે સૌ આપણો ટેક્સ યોગ્ય રીતે અને સમયસર ભરીએ.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પ્રકાશિત થયેલ છે)

“રોયલ્ટી” અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે આવી રહી છે નોટિસો!!

“માઈનિંગ” (ખાણ) સાથે જોડાયેલ ધંધાર્થીઓને ૨૦૧૭-૧૮ના વર્ષથી વેરાની જવાબદારી ભરવા આપવામાં આવી છે મસમોટી નોટિસો

તા. ૦૬.૦૮.૨૦૨૪

જી.એસ.ટી. કાયદો ૦૧ જુલાઈ ૨૦૧૭થી લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ સરકાર દ્વારા મેળવવામાં આવતી સેવાઓ ઉપર નોંધાયેલ વેપારીઓએ રિવર્સ ચાર્જ (RCM) મુજબ વેરો ભરવાની જવાબદારી આપવામાં આવેલ છે. સરકારને કરવામાં આવતી “રોયલ્ટી”ની રકમની ચુકવણી એ સરકારની સેવા બદલની ચુકવણી ગણાય કે ટેક્સ તરીકેની રકમ ગણાય તે બાબતે જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જ અસમંજસની સ્થિતિ પ્રવર્તતી હતી. જો “રોયલ્ટી” એ ટેક્સ ગણાય તો ટેક્સ ઉપર રિવર્સ ચાર્જ હેઠળ જી.એસ.ટી. લાગુ પડે નહીં. માનનીય સુપ્રીમ કોર્ટના હાલમાં ૮૧ ના પ્રમાણમાં જજોના આદેશ દ્વારા એવું ઠરાવ્યું છે કે રોયલ્ટી” એ “ટેક્સ” ગણાય નહીં પરંતુ “ફી” ગણાય. આમ, વ્યક્તિ દ્વારા સરકારને ચુકવવામાં આવતી “રોયલ્ટી” તે ફી ગણાતી હોય તો તેના ઉપર રિવર્સ ચાર્જ (RCM) મુજબ વેરો ભરવાની



જવાબદારી આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન્ડિયા સિમેન્ટ વી. તામિલનાડુ રાજ્યના કેસમાં ઠરાવવામાં આવ્યું હતું કે સરકારને ચુકવવામાં આવતી “રોયલ્ટી” એ એક પ્રકારનો ટેક્સ છે. હાલ, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ એ કરદાતાઓ માટે દુસ્વપ્ન સાબિત થઈ શકે છે.

આ અંગે વાત કરતાં રાજકોટના એડવોકેટ ભાર્ગવ ગણાત્રા જણાવે છે કે “વર્તમાનમાં નામદાર સુપ્રિમ કોર્ટેના

Mineral Area Development Authority Versus M/s. Steel Authority of Indiaના લેન્ડમાર્ક જજમેન્ટ પછી માઈનિંગ રોયલ્ટી ઉપર RCMની જવાબદારી અંગેના વિવાદોથી કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ માટે અસમંજસ ની પરિસ્થિતિ સામે આવી ગઈ છે. પરંતુ, પહેલું કહેવાય છે ને કે There is always a light at the end of tunnel. એવી જ રીતે વર્તમાન સમયમાં. (૧) Mineral Area Development Authority Versus M/s. Steel Authority of Indiaના ચુકાદો એ રીપ્રોસ્પેક્ટીવ રાખવો એ પ્રોસ્પેક્ટીવ રાખવો એ અંગેનો નિર્ણય નામદાર સુપ્રિમ કોર્ટ એ અનામત રાખેલો છે. જો આ અંગે નામદાર સુપ્રિમ કોર્ટેનો ચુકાદો એ રહે કે, Mineral Area Development Authority Versus M/s. Steel Authority of Indiaના ઈફેક્ટ એ પ્રોસ્પેક્ટીવ હોવી જોઈએ તો. આપણે સૌ જાણીએ

છીએ તે રીતે વર્ષ ૧૯૮૮માં આવેલા ઈન્ડિયા સિમેન્ટ ના ચુકાદામાં નામદાર સુપ્રિમ કોર્ટે સાત જજની ખંડપીઠે એ ઠરાવ્યું હતું કે રોયલ્ટી એ એક ટેક્સ છે એ જજમેન્ટ ની અસર ૨૫ જુલાઈ ૨૦૨૪ સુધી રહેશે. આમ, Mineral Area Development Authority Versus M/s. Steel Authority of India જજમેન્ટની ઈફેક્ટ પ્રોસ્પેક્ટીવ હોવી એ કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ માટે રાહત ની વાત રહેશે. (૨) Mineral Area

Development Authority Versus M/s. Steel Authority of Indiaના જજમેન્ટના ૮૧થી એ ઠરાવવામાં આવ્યું છે કે પાલોમેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર પાસે મિનરલ રાઈટ્સ ઉપર ટેક્સ ઉધરાવવાનો અધિકાર નથી. વધુમાં નામદાર સુપ્રિમ કોર્ટેએ ડિન્ગીર રામપુરમાં ઠેરવેલું હતું કે ટેક્સ ઓન મિનરલ રાઈટ્સ = ટેક્સ ઓન રોયલ્ટી. આથી, આ ઉપરથી એક તકનો અને કાયદાકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ મુદ્દો એ કહી શકાય કે જો

કેન્દ્ર સરકાર પાસે મિનરલ રાઈટ્સ ઉપર ટેક્સ ઉધરાવવાનો અધિકાર ના હોય તો જી.એસ.ટી. કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને કર લગાવીને ઉધરાવે છે તે કેવી રીતે લગાવી શકાય? નોંધ- પ્રવર્તમાન માં, રોયલ્ટી પરની સર્વિસ ટેક્સ અને જી.એસ.ટી. અંગેના વિવાદો પર ચાલી રહેલી અતિ અગત્યના કેસની સુનવણી એટલે કે ઉદયપુર ચેમ્બર્સ ની સુનવણી એ ૨૩ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ થવા જઈ

રહી છે’.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા પ્રમાણમાં ખાણખનીજ- માઈનિંગ લીઝ ધરાવતા વ્યક્તિઓને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસો ૦૧.૦૭.૨૦૧૭ થી ૩૦.૧૧.૨૦૨૨ સુધીના સમય માટે આપવામાં આવી હોવાના અહેવાલ છે. અમુક કિસ્સાઓમાં કોઈ એક વર્ષ તો અમુક કિસ્સાઓમાં એક સામટી આ નોટિસ આપવામાં આવી રહી છે અને લાખો કરોડોની વસુલાત અંગે ઉલ્લેખ કરવામાં આવી રહ્યું છે. આ નોટિસો આવતા કરદાતાઓમાં માટે તથા ટેક્સ પ્રોફેશનલ્સની દોહાદોહી વધી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. વિવિધ ટેક્સ પ્રોફેશનલ્સ પોતાના અસીલો સાથે મળી આ અંગે કોર્ટમાં જવાના વિકલ્પો વિષે વિચાર કરી રહ્યા છે તો વિવિધ એસોસિએશન પણ આ બાબતે લડત કરવા વિચાર કરી રહ્યાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

સવાલ આપના જવાબ 'ટેક્સ ટુડે' એક્સપર્ટના

Dt 13.08.2024

Goods Services Tax

અમારા અસીલ સોનાના ખરીદ વેચાણનો ધંધો કરે છે. તેઓની દુકાને ચોરી થવાના કારણે ૧૫ લાખ રોકડા અને ૧૦ લાખના ઘરેણાંનું નુકસાન થયેલ છે. જી.એસ.ટી. હેઠળ શું આની શું અસર થશે? - કોલીપરા સુદરિયા, પોતુર

જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ રોકડમાં થયેલ નુકસાનની કોઈ અસર આવે નહીં. ૧૦ લાખના ઘરેણાં જે ચોરી થયેલ છે તેની અગાઉ લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ આપના અસીલ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ ૧૭(૫) હેઠળ રિવર્સ કરવાની રહે તેવો અમારો મત છે.

અમારા અસીલને ૨૦૧૯-૨૦ માટે DRC-01ની રૂ.૦૫.૨૦૨૪ ના તારીખ વાળી કલમ ૭૩ હેઠળની નોટિસ ૧૩.૦૭.૨૦૨૪ના રોજ રજિસ્ટર્ડ કોપી મળેલ છે. પોર્ટલ ઉપર આ નોટિસ હજુ દર્શાવેલી નથી. શું આ નોટિસ ટાઇમ બાર્ડ કહેવાય? - જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ, ડીસા

જવાબ: આપના અસીલને ઇ મેઈલ દ્વારા નોટિસ મળી છે કે નહીં તે ચેક કરશો. જો ઇ મેઈલ દ્વારા પણ નોટિસ સમયસર મળી ના હોય તો આ કલમ ૭૩ હેઠળની નોટિસ ટાઇમ બાર્ડ મળી છે તેમ ગણાય તેવો અમારો મત છે.

અમારા અસીલનું ૨૦૨૩-૨૪ નું ટર્નઓવર ૫ કરોડથી વધુ થઈ ગયું છે. તેઓની ૦૧.૦૪.૨૦૨૪થી ઇ ઈવોઈસની જવાબદારી આવે. અત્યાર સુધી તેઓ દ્વારા ઇ ઈવોઈસ બનાવેલ નથી. તો શું હવે ઇ ઈવોઈસ બનાવી શકાય કે નહીં? - જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ

જવાબ: હા, આપના અસીલ હાલ પણ જૂના ઈવોઈસ ઉપરથી ઇ ઈવોઈસ બનાવી શકે. આ આકારણી દરમ્યાન આ “ઇ ઈવોઈસ” મોડા બનાવવા બદલ પેનલ્ટીનો પ્રશ્ન ઉદભવી શકે છે તેવો અમારો મત છે.

ઈન્કમ ટેક્સ

અમારા અસીલ સોનાના ખરીદ વેચાણનો ધંધો કરે છે. તેઓની દુકાને ચોરી થવાના કારણે ૧૫ લાખ રોકડા અને ૧૦ લાખના ઘરેણાંનું નુકસાન થયેલ છે. ઈન્કમ ટેક્સ હેઠળ શું આ રકમ ખર્ચ તરીકે બાદ મળશે? - કોલીપરા સુદરિયા, પોતુર

જવાબ: હા, આ રકમ ખર્ચ તરીકે બાદ મળે. પણ ભવિષ્યમાં આ ચોરીની સામે કોઈ વીમાની રકમ આપના અસીલને મળે તો આ રકમ આવક ગણવાની રહે. અમારા મતે “ક્લેઈમ પ્રોસેસ” માં જે રકમ દર્શાવી છે તે જ રકમ કે અન્ય કોઈ રકમ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મળે તો આ રકમ આવકમાં ઉમેરવાની રહેશે.

અમારા અસીલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું રિટર્ન 44ADA હેઠળ ભરવામાં આવેલ છે. આ રિટર્નમાં એડવાન્સ ટેક્સની રકમ રૂ.૦૦૦૦ જેવી ભરવામાં આવી હતી. આ રકમ પેકી તેઓ દ્વારા ૬૦૦૦૦/- જેવું રિફંડ માંગવામાં આવેલ છે. શું સ્ક્રૂટીની ની શક્યતા આ મોટા રિફંડના કારણે રહે? - કોલીપરા સુદરિયા, પોતુર

જવાબ ના, માત્ર રૂ.૫૦૦૦૦/- ના એડવાન્સ ટેક્સ માંથી ૬૦૦૦૦/- જેવી ઈન્કમ ટેક્સની રકમ રિફંડ માંગવાના કારણે ઈન્કમ ટેક્સ હેઠળ સ્ક્રૂટીનીની શક્યતા રહે નહીં તેવો અમારો મત છે.

17.08.2024

Goods & Services Tax

અમારા અસીલ જનરલ ઈન્સ્યુરન્સ એજન્ટ છે. તેઓનું સર્વિસનું ટર્નઓવર ૨૦ લાખથી વધુ છે. શું તેઓ જી.એસ.ટી. લેવા જવાબદાર છે? જો જી.એસ.ટી. લેવા જવાબદાર ના હોય પણ જી.એસ.ટી. લઈ લીધો હોય તો જી.એસ.ટી. ભરવાની જવાબદારી ઈન્સ્યોરન્સ કંપનીની આવે કે અમારા અસીલની? - ધાર્મિન રામાણી, રાજકોટ

જવાબ: જી.એસ.ટી. કાયદાના નોટિફિકેશન સેક્ટરલ ટેક્સ (રેઈટ) ૧૩/૨૦૧૭, તારીખ ૨૮.૦૬.૨૦૧૭ મુજબ ઈન્સ્યોરન્સ એજન્ટની સેવાનો સમાવેશ RCM હેઠળ કરવામાં આવ્યો છે. આમ, આ સેવા ઉપર ઈન્સ્યોરન્સ કંપની વેરો ભરવા જવાબદાર છે. આપના અસીલનું ટર્નઓવર ૨૦ લાખ ઉપર થયું હોવા છતાં તેઓ જી.એસ.ટી. નોંધણી નંબર લેવા જવાબદાર નથી તેવો અમારો મત છે. જી.એસ.ટી. નંબર મેળવી લીધો હોય તો પણ તેઓએ



આ રકમ GSTR 1 માં Payable under RCMમાં ટીક કરી શકે અને આ વ્યવહારની જી.એસ.ટી. ભરવાની જવાબદારી ઈન્સ્યોરન્સ કંપનીની આવે તેવો અમારો મત છે.

અમારા અસીલ દ્વારા જે જગ્યા ઉપર જી.એસ.ટી. ની માંગણી કરવામાં આવી રહી છે તે રહેણાંકી મિલકત છે. આ મિલકત સંદર્ભે તમામ વિગતો

પૂરી પાડી હોવા છતાં માત્ર રહેણાંકી મિલકત હોવાના કારણે આ નોંધણી દાખલો આપવામાં આવતો નથી. માત્ર આ કારણે જ અમારી નોંધણી અંગેની અરજી ૩ થી ૪ વાર નામંજૂર કરવામાં આવી છે. શું રહેણાંકી મિલકતમાં જી.એસ.ટી. નંબર ના મળે તે અધિકારીનું કારણ યોગ્ય છે? - જગદીશભાઈ વ્યાસ, ડીસા.

જવાબ: ના, રહેણાંકી મિલકત ઉપર જી.એસ.ટી. ના મળે તેવો કોઈ નિયમ છે નહીં. આ અરજીમાં જ્યારે ‘કવેરી’ ઊભી કરવામાં આવે ત્યારે આપના ધંધાને લગતી તમામ વિગતો અંગે એક વિગતવાર નોંધ લખી વિગત અપલોડ કરો. શક્ય હોય તો આ અંગે સોલ્ડનામું કરો. આ પ્રકારે વિગતો આપવાથી જી.એસ.ટી. નંબર એલોટ થવાની શક્યતા છે. આ અંગે જો સેક્ટરલ ડિપાર્ટમેન્ટની નોટિસ હોય તો ‘સેક્ટરલ રજીસ્ટ્રેશન ઓફિસ નંબર’ ઉપર ફોન કરી આ અંગે વિગતો આપી શકો છો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય તો રૂબરૂ મળી તમારી સમસ્યા અંગે વાકેફ કરી શકો છો.

અમારા અસીલ પોતાની જ જમીન ઉપર મકાન-દુકાન બાંધકામ કરી વેચાણનો ધંધો કરે છે. તેઓ કંપલીશન સર્ટિફિકેટ મળ્યા પછી જ આ વેચાણ કરે છે. ક્યારેક કંપલીશન સર્ટિફિકેટ મળ્યા પછી લાંબા સમય સુધી મકાન-દુકાન વેચાણ થયા વગર પડી હોય છે. આવા સમયે મિલકત જાળવવા કોઈ ખર્ચ કરવો પડતો હોય છે. શું આ કારણે અમારી જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? - કાપડિયા જીતેશ, જેતપુર

જવાબ: ના, કંપલીશન સર્ટિફિકેટ મળ્યા બાદ ભલે મિલકત જાળવણી પેટે ખર્ચ કરવામાં આવ્યો હોય, તો પણ જી.એસ.ટી. ની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

કરદાતા દ્વારા દ્વારા GSTR 9 ફાઇલ કરવામાં આવ્યું છે પણ GSTR 9C ફાઇલ કરવામાં આવ્યું હોય પરંતુ 9C ફાઇલ કરવામાં ના આવ્યું હોય તો શું જી.એસ.ટી. કાયદાની કલમ ૧૨૫ ની જનરલ પેનલ્ટી લાગુ પડે? જીતેશ કાપડિયા, જેતપુર

જવાબ: હા, 9C ફાઇલ કરવામાં મોડું થયું હોય તો જી.એસ.ટી. કાયદાની કલમ ૧૨૫ હેઠળ જનરલ પેનલ્ટી લાગુ પડી શકે તેવો અમારો મત છે.

અમારા અસીલ ફરસાણ ઉત્પાદન કરી વેચાણ કરવાનો ધંધો કરે છે. તેઓનો ધંધો માત્ર કાઉન્ટર ઉપરથી માલ વેચાણ કરવાનો છે તેઓ ત્યાં બેસી ફરસાણ પીરસવાની સગવડ નથી. તેઓનું ટર્નઓવર ૧.૫ કરોડ થી ઓછું છે. શું તેઓ કંપોઝીશન સ્કીમ હેઠળ ૧% નો લાભ લઈ શકે? શું તેઓ ‘સ્વીગી’, ‘ઝોમ્બો’ વગેરે ઓનલાઈન

ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

કંપની દ્વારા ઓનલાઈન વેચાણ કંપોઝીશન માં હોય તો પણ કરી શકે? - વિક્રમ જોશી, એડવોકેટ, રાજકોટ

જવાબ: હા, માત્ર ઉત્પાદન કરી માલ વેચાણનો ધંધો કરતાં હોય તો ફલ ટર્નઓવર ઉપર ૧% જી.એસ.ટી. ભરી કંપોઝીશન નો લાભ લઈ શકે છે તેવો અમારો મત છે. આપના અસીલ કંપોઝીશન સ્કીમ હેઠળ હોય

તો ‘સ્વીગી’, ‘ઝોમ્બો’ પર વેચાણ કરી શકે. આ ઓનલાઈન વ્યવહારો ઉપર ઇ કોમર્સ કંપની RCM લેખે વેરો ભરશે તેવો અમારો મત છે.

અમારા અસીલ સામે અધિકારી દ્વારા ૭૩(૬) માં આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં બે પ્રકારની જવાબદારી ઊભી થઈ છે. આઉટપુટ બાજુ, ૬૦૦૦ અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર થતાં ૧૫૦૦૦૦. જે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ડીસએલાય થઈ છે તે સર્ક્યુલર ૧૮૩/૧૫/૨૦૨૨ મુજબ અપીલમાં ફોપ થઈ શકે તેમ છે. શું એમ્નેસ્ટી સ્કીમ હેઠળ આઉટપુટ લાયાબીલીટી સામે લાભ લઈ ઈન્પુટ બાબતે અપીલ કરી શકાય?

- મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: કલમ 128A પસાર થઈ ગઈ છે પરંતુ નોટિફાઇ થઈ નથી. ઉપરાંત આ ‘એમ્નેસ્ટી’ બાબતે વિગતવાર સર્ક્યુલર પણ આવે તેવી સંભાવના છે. અમારો મત છે કે આ બાબતે જી.એસ.ટી. ની કલમ નોટિફાઇ થાય અને સર્ક્યુલર આવે ત્યારે જ ચોક્કસ જવાબ આપી શકાય.

અમારા અસીલ દ્વારા અપીલ ૨૪૦ દિવસ મોડી કરવામાં આવી હતી. અપીલ અધિકારી દ્વારા અમારી ડીલે કોંડોનની વિગતો, રજૂ કરેલ એફિડેવિટ ધ્યાને લીધા સિવાય, સુનાવણીની તક આપ્યા સિવાય આ અપીલ નામંજૂર કરવામાં આવી છે. આ સામે અમારી પાસે ક્યાં વિકલ્પ રહેલા છે? - મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: રૂબરૂ સુનાવણીની તક આપવામાં ના આવી હોય તો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું ના હોય તેમ ગણાય. આ બાબતે હાઈકોર્ટમાં રિટ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ રહે તેવો અમારો મત છે. આ અંગે ટેક્સ ટુડેનો એડવોકેટ ભાર્ગવ ગણાત્રા દ્વારા લખવામાં આવેલ ખાસ લેખ જોઈ જવા વિનંતી.

અમારા અસીલનું ટર્નઓવર ગત વર્ષ કરતાં ઘણું ઓછું થયું હોય, અધિકારી દ્વારા અમારા અસીલની ધંધાની જગ્યાની મુલાકાત લઈ કારણ પુછવામાં આવ્યા હતા. શું જી.એસ.ટી. કાયદાની કોઈ જોગવાઈ આ સત્તા અધિકારીને આપે છે? - કોલીપરા સુદરિયા, પોતુર

જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારીઓને ઘણી સત્તા આપવામાં આવેલ છે. હા આ સત્તા નો ઉપયોગ પૂરી રીતે વિધિ પૂર્ણ કરી કરવાનો થાય છે. આ પ્રકારે વિગતો લેવા મોટાભાગે અધિકારી યોગ્ય કાર્યવાહી કર્યા વગર જ કરતાં હોય છે. આપના અસીલ આ સત્તા અંગે લેખિતમાં આપવા માંગ કરી શકો છો.

અમારા અસીલ ‘ડિટોનેટર બ્લારિટિંગ’નો ધંધો કરે છે. આ બ્લારિટિંગના ધંધા માટે ખાનમાં બ્લારિટિંગ કરવા મશીનરી તથા માલની હેરફેરમાં ટ્રેક્ટર ઉપયોગી રહે છે. શું તેઓ દ્વારા ટ્રેક્ટર ખરીદી કરવામાં આવે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે?

જવાબ: હા, આપના ધંધા માટે ઉપયોગ થતાં ટ્રેક્ટરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.

અમારા અસીલ ‘મેન પાવર’ પૂરી પાડવાની સેવા આપે છે. તેઓ ગુજરાતમાં રજિસ્ટર્ડ છે. તેઓ સેવા દીવના કરદાતાને આપે છે. શું તેઓએ દીવ નંબર લેવો ફરજિયાત બને કે તેઓ IGST નું બિલ બનાવી આ સેવા આપી શકે છે?

જવાબ: મેન પાવરની સેવાનું બિલ ગુજરાતના વેપારી દીવના વેપારીને IGST નું બિલ બનાવી આપી શકે છે અને દીવમાં જી.એસ.ટી. લેવાની ફરજિયાત જરૂર રહે નહીં તેવો અમારો મત છે.

-: ખાસ નોંધ :-

૧. જી.એસ.ટી. ની જોગવાઈઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્પણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.

૨. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગેના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડવાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

૩. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

આ કૌલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ-મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર: આ કૌલમ ‘ટેક્સ ટુડે’ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

ઓલ ગુજરાત ફેડરેશન દ્વારા પાલનપુર ખાતે ઈન્કમ ટેક્સ અને જીએસટી વિષય પર સેમિનાર યોજાયો



૨૭.૦૭.૨૦૨૪: ગુજરાતની નામાંકિત સંસ્થા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, પાલનપુર - બનાસકાંઠા સીપીઈ સ્ટડી ચેપ્ટર ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ, ટેક્સ પ્રેક્ટિટશનર એસોસિએશન પાટણ, લાયન્સ કલબ ઓફ પાલનપુર અને રોટરી કલબ પાલનપુર સીટી દ્વારા ઈન્કમેટેક્સ કાયદા અન્વયે સેમિનાર યોજાયો. આ સેમિનાર એજએક્ઝ ટીસી પ્રમુખ વિશ્વેશ શાહ, આઈપીપી સીએ રવી શાહ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ આશુતોષ ઠક્કર, મંત્રી મુદાંગ વકીલ, મોડિફાયલ પ્રોગ્રામ કમિટી ચેરમેન પ્રફુલભાઈ શાહ, વક્તાશ્રી સીએ હરિત ધારીવાલ અને વક્તાશ્રી સીએ પુનિત પ્રજાપતિ અન્ય સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓ ના વરદ હસ્તે ઉદ્ઘાટિત કરેલ.

ઈન્કમેટેક્સ વિષય પર વક્તાશ્રી સીએ હરિત ધારીવાલ અને

જીએસટી કાયદા પર વક્તાશ્રી સીએ પુનિત પ્રજાપતિએ ઉમદા અને રસપ્રદ વક્તવ્ય આપી સૌ ઉપસ્થિત ટેક્સ વ્યવસાયિઓ અને વેપારીઓ ને મંત્ર મુગ્ધ કરી દીધેલ. વધુમા આ પ્રસંગે સંસ્થામાં વિશેષ યોગદાન આપવા બદલ પાસ્ટ પ્રેસિડન્ટશ્રી બકુલભાઈ શાહનું પ્રશસ્તી પત્ર આપી સન્માનિત કરાયા.

આ સેમિનાર મા પાસ્ટ પ્રેસિડન્ટ ધ્રુવેન શાહ, હિરેનભાઈ વકીલ, કાર્તિકેય શાહ, બકુલભાઈ શાહ, કારોબારી સભ્યોમાં મૌલીક પટેલ, અમિત સોની, રાજેન્દ્ર કાબરા, રમેશ કથરાની, મહેન્દ્ર સ્વામી, ધ્રુવેન મહેતા તથા ટેક્સ વ્યવસાયિઓ અને સહયોગી સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં જોડાઈ સેમિનાર ને સફળ બનાવેલ.

હર્ષભાઈ ઓઝા તથા અમિતભાઈ સોની, ટેક્સ ટુડે

DSC SCHOOL OF COMMERCE

Veraval Road, Near Lamdhar Fatak, UNA MA. +91 8758470700

ધોરણ ૧૦ માં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ૩૦% સુધીની સ્કોલરશીપ

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની ઉના પીપલ્સ કો-ઓપ બેન્કની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની DEO ની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની GST ઓફીસની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની INCOME TAX ઓફીસની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની માહિતી જીનિય ઈન્ડ.ની મુલાકાત

DSC સ્કૂલના વિદ્યાર્થીઓની કેલારા કોટન પ્રા.લી.ની મુલાકાત

એડમિશન ઓપન

ધોરણ: ૧૧ અને ૧૨ કોમર્સ

ઇંગ્લીશ/ગુજરાતી મીડીયમ

શા માટે કોમર્સ DSC SCHOOL OF COMMERCE ???

- કોમર્સ શીખો કોમર્સ વિષયના તજજ્ઞો પાસેથી
- વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ માટે વિવિધ ઈન્ડસ્ટ્રીઝની મુલાકાતો
- વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ માટે વિવિધ બેન્કો તથા જી.એસ.ટી., ઈન્કમ ટેક્સ જેવી સરકારી ઓફીસની મુલાકાતો
- જી.એસ.ટી. અધિકારી, ઈન્કમ ટેક્સ અધિકારી જેવા સરકારી અધિકારીઓ, નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નિષ્ણાંત વકીલો જેવા તજજ્ઞોના લેક્ચરોનો લાભ
- કોમર્સના વિવિધ વિષયો ઉપર વિદ્યાર્થીઓને લગતા વેબીનાર